



Q 1. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તરો લખો.

1. એક મૂરખને કેવી ટેવ છે?
2. અખાના મતે જ્યાં જોઈએ ત્યાં શું જોવા મળે છે ?
3. અખો ગુજરાતી સાહિત્યમાં કયા નામે પ્રખ્યાત છે?
4. ધુવડની ખાસિયત કઈ છે કે જે તેને બીજા પ્રાણી પંખીથી અલગ પાડે છે?
5. " મૂકી હીરો ઉપાડે પહાણ" એટલે શું?

Q 2. સાચો સમાનાર્થી શબ્દ લખો..

1. ધુડ =
2. ઉત્પાત =
3. ટેવ =
4. પહાણ =
5. સનાન =

Q 3. નીચે આપેલા શબ્દોના વચન બદલો .

- | | |
|-----------|----------|
| 1. હીરો | 4. માણસ |
| 2. ડાહ્યા | 5. ઢોંગી |
| 3. પથ્થરો | 6. મૂર્ખ |

Q 4. નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દો લખો.

- | | |
|-------------|------------|
| 1. દેવ x | 4. રાત x |
| 2. ડાહ્યો x | 5. નાનું x |

ANSWER KEY

Q 1. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તરો લખો.

1. એક મૂરખને કેવી ટેવ છે?

Ans : એક મૂરખ વ્યક્તિ જેટલા પથ્થર હોય તેમને દેવ માની પૂજે છે, જ્યાં પાણી જુએ કે તેને પવિત્ર સમજી તેમાં સ્નાન કરવા લાગે છે, અને તુલસીનો છોડ જોતાં જ તેના પાંદડા તોડવા માંડે છે. દૂકમાં બાહ્ય આચારમાં રચ્યો પરચ્યો રહે છે.

2. અખાના મતે જ્યાં જોઈએ ત્યાં શું જોવા મળે છે ?

Ans : અખાના મતે જ્યાં જોઈએ ત્યાં ફૂડ અને કપટ જોવા મળે છે.

3. અખો ગુજરાતી સાહિત્યમાં કયા નામે પ્રખ્યાત છે?

Ans : અખો ગુજરાતી સાહિત્યમાં ' જ્ઞાનના ગરવા વડલા' તરીકે પ્રખ્યાત છે.

4. ધુવડની ખાસિયત કઈ છે કે જે તેને બીજા પ્રાણી પંખીથી અલગ પાડે છે?

Ans : ધુવડ દિવસે સૂર્યના પ્રકાશમાં જોઈ શકતું નથી. તે માત્ર અંધારામાં જ બહાર નીકળે છે. માટે તે પોતાના જીવનમાં ક્યારેય સૂર્ય પ્રકાશનો અનુભવ કરી શકતું નથી.

5. " મૂકી હીરો ઉપાડે પહાણ" એટલે શું?

Ans : " મૂકી હીરો ઉપાડે પહાણ" એટલે કીમતી વસ્તુનું મૂલ્ય સમજ્યા વગર તેનો અસ્વીકાર કરવો અને નકામી વસ્તુને કીમતી સમજી તેને સાચવી રાખવી.

Q 2. સાચો સમાનાર્થી શબ્દ લખો..

1. ધુડ = ધુવડ

2.ઉત્પાત = પીડા, દુઃખની વાત

3. ટેવ = આદત

4. પહાણ = પથ્થર

5. સનાન = સ્નાન, નહાવું તે

Q 3. નીચે આપેલા શબ્દોના વચન બદલો .

1. હીરો - હીરા

2. ડાહ્યા - ડાહ્યો

3. પથ્થરો - પથ્થર

4. માણસ - માણસો

5. ઢોંગી - ઢોંગીઓ

6. મૂર્ખ - મૂર્ખો

Q 4. નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દો લખો.

1. દેવ x દાનવ

2. ડાહ્યો x ગાંડો

3. અજવાળું x અંધારું

4. રાત x દિવસ

5. નાનું x મોટું

6. આગળ x પાછળ

Dear Students, please write all these exercises in your notebooks.